

સિટી સહ ઈમેન્સિપેશન ડેની ઉજવણી ઓગસ્ટ 1ના રોજ

બ્રેમ્પટન, ઓન્ટારિયો (15 જુલાઈ 2022) – રોજ સિટી ઓફ બ્રેમ્પટન આપ સહુને ઈમેન્સિપેશન ડેની ઉજવણી કરવાનું આમંત્રણ પાઠવે છે, જે વિશ્વભરમાં આફ્રિકન વંશના લોકોની ગુલામી નાબૂદ થયાના દિન તરીકે સ્વીકારવામાં આવ્યો છે અને જે સોમવાર, ઓગસ્ટ 1ના રોજ ઉજવાઈ રહ્યો છે.

આ વર્ષે ઈમેન્સિપેશન પાર્કની જયંતીના સ્મરણાર્થે અને ઈમેન્સિપેશન ડેનો સ્વીકાર કરવા સિટી ઈમેન્સિપેશન પાર્કમાં મધ્યાહ્નથી સાંજે 8 વાગ્યા સુધી કેરિબિઅન ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે. ઈવેન્ટમાં હાજર રહેવાવાળા લોકો ફૂડના વિક્રેતાઓ, કેરિબિઅન ક્રાફ્ટ્સ માર્કેટ, લાઇવ મનોરંજન અને બીજું ઘણું બધું માણી શકશે.

2020માં રિક્સ 407 સ્પોર્ટ્સ પાર્કનું નામ બદલીને ઈમેન્સિપેશન પાર્ક કરીને સિટીએ પ્રથમ વખત ઈમેન્સિપેશન ડેનો સ્વીકાર કર્યો હતો જેમાં નાના અને મોટા સોકરના મેદાનો છે તેમજ ક્રિકેટના મેદાનો છે. આ વર્ષે સિટી બધાને કેરિબિઅન ધરોહર અને સ્વાતંત્ર્યને અને બ્રેમ્પટનના અશ્વેત સમાજના યોગદાનને સન્માનિત કરવાનું આમંત્રણ પાઠવીએ છીએ, અને કલા, સંસ્કૃતિ, વ્યંજનો અને સમાજ સંગ આપણા વૈવિધ્યને ઉજવીશું.

ઈવેન્ટ અંગેની વધુ જાણકારી અહીંથી મળશે brampton.ca.

સુવાક્યો

"બ્રેમ્પટનનું પચરંગીપણું આપણા શહેરને આટલું અજોડ બનાવે છે અને તે માટે આપણા સહુ માટે ગર્વ લેવા જેવી બાબત છે. ઓગસ્ટ 1ના રોજ ઈમેન્સિપેશન ડે પર અમારી સાથે જોડાવા માટે અમે રહેવાસીઓને આમંત્રણ પાઠવીએ છીએ જ્યાં કલા, સંસ્કૃતિ, વ્યંજનો અને સમુદાયનો સંગમ હશે અને સાથે જ બ્રેમ્પટનના અશ્વેત સમુદાયના યોગદાન તેમજ કેરિબિઅન ધરોહર અને સ્વાતંત્ર્યનો સ્વીકાર કરીશું. સાથે મળીને અમે ભૂતકાળનું સ્મરણ કરીશું અને સાથે જ તમામ લોકો માટે સમાન અને ન્યાયી ભવિષ્ય તરફ ડગ માંડીશું.

- પેટ્રિક બ્રાઉન, મેયર, સિટી ઓફ બ્રેમ્પટન

"કાર્યસ્થળ પર તેમજ આપણા સમાજમાં સિટી ઓફ બ્રેમ્પટન વૈવિધ્ય, સમાનતા અને સમાવેશિતાને વરેલું છે. વાર્તાલાપમાં જોડાવા માટે અને અશ્વેત સંસ્કૃતિ અને બ્રેમ્પટનના અશ્વેત સમાજનો સ્વીકાર કરવા માટે અમે રહેવાસીઓને અમારી સાથે ઈમેન્સિપેશન ડેના પ્રસંગે અમારી સાથે જોડાવા આમંત્રણ પાઠવીએ છીએ.

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રેમ્પટન

"ઈમેન્સિપેશન ડે અશ્વેત વંશના લોકોની બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીમાંથી મુક્તિનો પ્રતિક દિન છે. 01 ઓગસ્ટ 1834ના રોજ જ્યારથી કાનૂન અમલી બન્યો, ત્યારથી આ દિવસ આફ્રિકન વંશ અને અશ્વેત સમાજને પ્રતિબિંબિત કરે છે અને તેમની ધરોહર અને સંસ્કૃતિનો સ્વીકાર છે. તે વિવિધતા, સમાનતા, સમાવેશીતા અને જાતિવાદરોધી બાબતો પર મહત્વપૂર્ણ ચર્ચા ચાલુ રાખવાનો અવસર પણ પૂરો પાડે છે. તે બાબતની નોંધ લેવી અગત્યની છે કે અપર કેનેડા (ઓન્ટારિયો)એ 1793માં ગુલામીની પ્રથાને ધીમે ધીમે સમાપ્ત કરવા માટે એક અધિનિયમ પસાર કર્યો અને મોટા ભાગના કેનેડાના પ્રાંતો 1834ની પહેલા જ ગુલામીની પ્રથા નાબૂદ કરતા કાનૂનો પસાર કરી ચુક્યા હતા. આફ્રિકન અને કેરેબિયન ધરોહરને અને સ્વતંત્રતાને વધાવી લેવા માટે અમારા ઈમેન્સિપેશન ડેના ઈવેન્ટમાં અમારી સાથે જોડાઓ, બ્રેમ્પટનના વૈવિધ્યને વધાવો અને કેનેડા તેમજ આખા વિશ્વમાં ગુલામી નાબૂદ કરવા માટે થયેલ બલિદાનોનો સ્વીકાર કરો.

-મિશેલ બર્ન, મેનેજર, ઈકિવટી ઓફિસ, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે શેકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca